

રાજકોટ મહાનગરપાલિકા

ડો. આંબેડકર ભવન, ઢેબરભાઈ રોડ, રાજકોટ-૩૬૦ ૦૦૧

-: અખબારી યાદી:-

“વન વીક, વન રોડ” ઝુંબેશ

વેસ્ટ ઝોનમાં ૧૫૦ ફૂટ રીંગ રોડ ખાતે વિવિધ શાખા દ્વારા કામગીરી હાથ ધરાઈ:

તારીખ: ૧૮-૦૧-૨૦૨૨

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરને સ્માર્ટ સિટી અંતર્ગત સુંદર, રળિયામણું બનાવવા તથા ટ્રાફિક મૂવમેન્ટ સરળ થાય તથા રાહદારીઓને થતી મુશ્કેલીઓના નિવારણ માટે શહેરમાં આવેલ મુખ્ય ૪૮ માર્ગો પર “વન વીક, વન રોડ” ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં આજે તા. ૧૮-૦૧-૨૦૨૨ના રોજ વેસ્ટ ઝોનમાં ૧૫૦ ફૂટ રીંગ રોડ (મવડી ચોકડી થી પુનીતનગર ચોક સુધીના રોડ) ખાતે અલગ અલગ શાખા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ફૂટપાથ અને રોડ સમારકામ, હંગામી ધોરણે અનઅધિકૃત દબાણ હટાવવું, ગેરકાયદેસર દબાણ પર ડિમોલીશનની કામગીરી, રોડનું સ્ટ્રક્ચર સરખું કરવું, ફૂડ શાખા દ્વારા ચકાસણી, નડતરરૂપ ઝાડને ટ્રીમીંગ કરવું, વેરા વસુલાત શાખા દ્વારા સ્થળ પર જ ટેક્સ વસુલાત કરવી, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા જાહેરમાં કચરો ફેલાવતા / કચરાપેટી ન રાખતા / પ્રતિબંધિત પ્લાસ્ટીકનો વપરાશ કરતા આસામીઓ સામે દંડની કાર્યવાહી કરેલ અને રોડ સારો દેખાય તે પ્રકારે કામગીરી કરવામાં આવે છે.

(ટાઉન પ્લાનિંગ શાખાની કામગીરી)

વન વીક વન રોડ અંતર્ગત શહેરના વેસ્ટ ઝોન વિસ્તારના ૧૫૦ ફૂટ રીંગ રોડ (મવડી ચોકડીથી ગોંડલ ચોકડી સુધી) પરના પાર્કિંગ તથા માર્જીનમાં થયેલ નીચેની વિગતો થયેલ દબાણો/ગેરકાયદેસર બાંધકામ દુર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવેલ છે.

ક્રમ	વો ડ	મિલકતનું નામ	સરનામું	બિલ્ડીંગ્સ માં પાર્કિંગ +૦.૦૦ લેવલ	પાર્કિંગ સ્પેશમાં પાર્કિંગ થાય તે માટે જરૂરી વ્યવસ્થા.	માર્જીન સ્પેસમાં કરવામાં આવેલ કાયમી દબાણ દુર કરાવેલ.	ચાલુ કન્સ્ટ્રક્શન સાઈટમાં ગ્રીન નેટ.	ચો.મી.
૧	૧૨	શ્રી રમેશભાઈ કે કોઠીયા	ઉમિયા ચોક, પરમેશ્વર મોટર			છાપરા દુર કરેલ છે		૧૫.૦૦

ક્રમ	વો ડ	મિલકતનું નામ	સરનામું	બિલ્ડીંગ્સ માં પાર્કિંગ +0.00 લેવલ	પાર્કિંગ સ્પેશમાં પાર્કિંગ થાય તે માટે જરૂરી વ્યવસ્થા.	માર્જીન સ્પેસમાં કરવામાં આવેલ કાયમી દબાણ દુર કરાવેલ.	ચાલુ કન્સ્ટ્રક્શન સાઈટમાં ગ્રીન નેટ.	ચો.મી.
			સામે, ૧૫૦' રીંગ રોડ, રાજકોટ					
૨	૧૨	શ્રી બાબુભાઈ ભરવાડ "મોમાઈ હોટલ"	ગોવર્ધન ચોક, ૧૫૦' રીંગ રોડ, રાજકોટ			છાપરા દુર કરેલ છે		૪.૦૦
૩	૧૨	શ્રી જીવનસિંહ જાડેજા	જે. બી. ઇન્ડસ્ટ્રીઝ/ ખોડિયાર બેટરીઝ એન્ડ ઓઈલ			છાપરા દુર કરેલ છે		૨૬.૦૦
૪	૧૩	શ્રી બાબુભાઈ ડાભી "મોમાઈ અનાજ ભંડાર"	ગોવર્ધન ચોક, ૧૫૦' રીંગ રોડ, રાજકોટ			છાપરા દુર કરેલ છે		૭.૦૦
૫	૧૩	શ્રી જેન્તીભાઈ પી. ભાલોડીયા "ઉમા ટાયર"	ગોવર્ધન ચોક, ૧૫૦' રીંગ રોડ, રાજકોટ			છાપરા દુર કરેલ છે		૫.૦૦
૬	૧૩	શ્રી સંદીપભાઈ પટેલ "શ્રીજી રેસ્ટોરન્ટ"	૧૫૦' રીંગ રોડ, રાજકોટ			છાપરા દુર કરેલ છે		૧૨.૦૦
૭	૧૩	શ્રી વાલાભાઈ ભરવાડ "ચામુંડા હોટલ"	૧૫૦' રીંગ રોડ, રાજકોટ			છાપરા દુર કરેલ છે		૧૩.૦૦
૮	૧૨	શ્રી અજય પટેલ "ઢોસા જી"	ગોવર્ધન ચોક, ૧૫૦' રીંગ રોડ, રાજકોટ			છાપરા તથા ઓટો દુર કરેલ છે		૨૪.૦૦
૯	૧૨	શ્રી કમલેશભાઈ મેવાડા "રાધે હોટલ"	૧૫૦' રીંગ રોડ, રાજકોટ			છાપરા દુર કરેલ છે		૧૪.૦૦
૧૦	૧૨	કિસ્મત સર્વિસ સ્ટેશન	સ્કાય હાઈટ સામે, ૧૫૦' રીંગ રોડ, રાજકોટ			છાપરા દુર કરેલ છે		૧૨.૦૦

(ફૂડ શાખાની કામગીરી)

- ખાધચીજના ભેંસના શુધ્ધ ઘી (લૂઝ) ના બે નમૂના તપાસ બાદ રિપોર્ટમાં સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ તથા પફ માટેનો બટેટાનો મસાલો (લૂઝ) નો નમૂનો તપાસ બાદ રિપોર્ટમાં અનસેફ ફૂડ જાહેર થયેલ
(૧) વોલગા ઘી ડેપો -કેવડાવાડી મેઇન રોડ , રાજકોટ મુકામેથી કેવલ જય પ્રકાશભાઈ ચંદ્રાણી પાસેથી લેવાયેલ ખાધચીજ - ભેસનું શુધ્ધ ઘી (લૂઝ) નો નમૂનો તપાસ બાદ રિપોર્ટમાં વેજીટેબલ ઓઇલ-ફોરેન ફેટ ની હાજરી મળી આવતા સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ.
(૨) ધ્રુવ મીઠાશ ઘી- મવડી માર્કેટ મેઇન રોડ રાજકોટ મુકામેથી પ્રતિકભાઈ પ્રદીપભાઈ પટેલ પાસેથી લેવાયેલ ખાધચીજ - ભેસનું માખણનું ઘી (લૂઝ) નો નમૂનો તપાસ બાદ રિપોર્ટમાં વેજીટેબલ ઓઇલ-ફોરેન ફેટ ની હાજરી મળી આવતા સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ.
(૩) હરિ યોગી લાઈવ પફ - પટેલ ચોક હરિ ધવા મેઇન રોડ રાજકોટ મુકામેથી ગૌરવ પ્રકાશભાઈ રુપારેલિયા પાસેથી લેવાયેલ ખાધચીજ - પફ માટેનો બટેટાનો મસાલો (લૂઝ) નો નમૂનો તપાસ બાદ રિપોર્ટમાં સિન્થેટિક ફૂડ કલર તથા નોન પરમિટેડ ઓઇલ સોલ્યુબલ ડાઈ ની હાજરી મળી આવતા અનસેફ ફૂડ જાહેર થયેલ.

- વન વીક વન રોડ અંતર્ગત FSSAI-2006 અન્વયે પ્રિપેડ ફૂડના લેવાયેલ ૨ નમૂના
- વન વીક વન રોડ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના મવડી ચોકડી થી પુનિત નગર ચોકડી, ૧૫૦ ફૂટ રીંગ રોડ વિસ્તારમાં આવેલ ખાણી-પીણીના ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૩૬ ફૂડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ. ચકાસણી દરમિયાન ૧૮ પેઢીને લાયસન્સ બાબતે નોટીસ આપેલ. તેમજ ૧૨ કી.ગ્રાં. વાસી અખાદ્ય ખોરાક સ્થળ પર નાશ કરેલ.

- નમૂનાની કામગીરી -

ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 મુજબ પ્રિપેડ ફૂડના ૨ નમૂના લેવામાં આવેલ :-

- (૧) રસાવાળા બટેટા (પ્રિપેડ સબ્જી લુઝ) સ્થળ- શ્રીજી રેસ્ટોરન્ટ -પુનિત નગર ચોક પાસે , ૧૫૦ ફૂટ રીંગ રોડ
- (૨) દાવત એ પનીર (પ્રિપેડ સબ્જી લુઝ) સ્થળ- નીરજ હોસપાલિટી LLP (ધ ગેલેરિયા હોટેલ) સંસ્કાર હાઇટ - ૧૫૦ ફૂટ રીંગ રોડ

- ખાણી-પીણી ના ધંધાર્થિઓની ચકાસણીની વિગત :-

ફૂડ વિભાગ દ્વારા તા. ૧૮/૦૧/૨૦૨૨ ના રોજ શહેરના મવડી ચોકડી થી પુનિત નગર ચોકડી ૧૫૦ ફૂટ રીંગ રોડ વિસ્તારમાં આવેલ (૧)શ્રીજી રેસ્ટોરન્ટ- વાસી મંચુંરિયન , ચટણી-ગ્રેવી, બાફેલા બટેટા, કુલ ૦૮ કી.ગ્રાં. સ્થળ પર નાશ તથા લાઇસન્સ બાબતે નોટિસ (૨)કિષ્ના વડાપાવ - વાસી દાબેલીનો મસાલો , વડાપાવ નો મસાલો, બાંધેલો લોટ કુલ ૦૪ કી.ગ્રાં. સ્થળ પર નાશ તથા લાયસન્સ બાબતે નોટીસ (૩)જય દ્વારકાધિસ ટી સ્ટોલ - લાયસન્સ બાબતે નોટીસ (૪)કર્મા પાન એન્ડ કોલડ્રિંકસ - લાયસન્સ બાબતે નોટીસ (૫)સાગર પાન એન્ડ કોલડ્રિંકસ - લાયસન્સ બાબતે નોટીસ (૬)શ્રી ગેલ કૃપા સેલ્સ એજન્સી - લાયસન્સ બાબતે નોટીસ (૭) પટેલ પાન એન્ડ કોલડ્રિંકસ - લાયસન્સ બાબતે નોટીસ (૮)ઉમિયાજી પાન એન્ડ કોલડ્રિંકસ - લાયસન્સ બાબતે નોટીસ (૯) પ્યાસા પાન એન્ડ કોલડ્રિંકસ - લાયસન્સ બાબતે નોટીસ (૧૦) માધવ પાન એન્ડ કોલડ્રિંકસ - લાયસન્સ બાબતે નોટીસ (૧૧)બાલાજી ગોલા એન્ડ આઇસક્રીમ - લાયસન્સ

બાબતે નોટીસ (૧૨)લક્ષ્મી સેલ્સ એજન્સી - લાયસન્સ બાબતે નોટીસ (૧૩) ક્રિષ્ના ટી સ્ટોલ - લાયસન્સ બાબતે નોટીસ (૧૪) સંતકૃપા સ્ટીમ હોકળા- લાયસન્સ બાબતે નોટીસ (૧૫)ગિરિરાજ પ્રોવિઝન સ્ટોર - લાયસન્સ બાબતે નોટીસ (૧૬)બંસી પાન - લાયસન્સ બાબતે નોટીસ (૧૭)જલારામ મેડિકલ સ્ટોર - લાયસન્સ બાબતે નોટીસ (૧૮)વત્સા સુપરમાર્કેટ -લાયસન્સ બાબતે નોટીસ આપેલ.

તથા (૧૯) યશ સુપરમાર્ટ & બેકર્સ (૨૦) જે માડી હોટેલ (૨૧)જોકર ગાઠિયા (૨૨)શ્રીજી મેડીકેર (૨૩)ડેરી ડેઝર્ટ આઇસક્રીમ (૨૪) નીલકંઠ ટ્રેડિંગ (૨૫)ઉમિયાજી પાન એન્ડ કોલડ્રિંકસ (૨૬) ગાત્રાળ ટી સ્ટોલ (૨૭)બલરામ હોટેલ (૨૮) મોમાઈ પાન એન્ડ કોલડ્રિંકસ (૨૯) વિજય હોટેલ (૩૦)ધ ફોર્ચ્યુન હોટેલ (૩૧)ધ ગેલેરિયા હોટેલ (૩૨)ચામુંડા હોટેલ (૩૩)ઓઈસા હાયપરમાર્ટ (૩૪)શુભમ ડિલક્ષ પાન એન્ડ કોલડ્રિંકસ (૩૫) ધર્મરાજ વડાપાવ (૩૬) ખોડિયાર પાન એન્ડ કોલડ્રિંકસ ની સ્થળ પર ચકાસણી કરેલ.

(સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની કામગીરી)

વન વીક વન રોડ અંતર્ગત ૧૫૦ ફૂટ રીંગ રોડ (મવડી ચોકડી થી પુનીતનગર ચોક સુધીના રોડ) પર જાહેરમાં કચરો ફેકનાર / ગંદકી કરવા સબબ કુલ ૨૦ આસામીઓ પાસેથી રૂ. ૫,૦૦૦/-, કચરાપેટી નુ રાખવા સબબ ૦૪ આસામીઓ પાસેથી ૧,૦૦૦/-નો વહીવટી ચાર્જ, પ્રતિબંધિત પ્લાસ્ટિક રાખવા / ઉપયોગ કરવા સબબ કુલ ૦૪ આસામીઓ પાસેથી રૂ. ૨,૦૦૦/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ , આમ, કુલ ૨૮ આસામીઓ પાસેથી રૂ. ૮,૦૦૦/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ.

(દબાણ હટાવ શાખાની કામગીરી)

વન વીક વન રોડ અંતર્ગત ૧૫૦ ફૂટ રીંગ રોડ (મવડી ચોકડી થી પુનીતનગર ચોક સુધીના રોડ) દબાણ હટાવ શાખા દ્વારા જપ્ત કરેલ રેકડી/કેબીનની સંખ્યા - ૦૧ અને જપ્ત કરેલ બોર્ડ-બેનર - ૪૭ જપ્ત કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે.

(જન સંપર્ક અધિકારી)
રાજકોટ મહાનગરપાલિકા